

બં. અ. કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવની ઊજવણીનો સમાપન સમારોહ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની બં. અ. કૃષિ મહાવિદ્યાલયના સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ કરી અમૃત મહોત્સવની ઊજવણીનો સમાપન સમારોહ કોલેજના ઓડીટોરીયમ ખાતે ૩જી સપ્ટેમ્બરના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયા સાહેબના પ્રમુખ સ્થાને યોજાયો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય સચિવશ્રી કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર તથા મહાનિર્દેશક, ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ, ન્યુ દિલ્હીના ડૉ. હિમાંશુ પાઠક સાહેબ તથા વિશેષ મહેમાન તરીકે ડૉ. ઝેડ. પી. પટેલ, કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને અતિથી વિશેષ તરીકે ડૉ. એમ. કે. ઝાલા, સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી અને દાનવીર સ્વ. અમૃતલાલ હરગોવિંદદાસના પૌત્રશ્રી અમિતભાઈ શેઠ તથા ડૉ. વાય. એમ. શુક્લ, પ્રિન્સીપાલ અને ડીનશ્રી અને કો-ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરીશ્રી ડૉ. ડી. બી. સીસોદીયા ની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મુકવામાં આવ્યો.

આ પ્રસંગની સાથો-સાથ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રની ફાર્મ કચેરીના નવા બિલ્ડીંગનું અનાવરણ કરવામાં આવ્યું. ૪.૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રીસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર મોર્ડનાઇઝેશન ઓફ મેઇન વેજીટેબલ રીસર્ચ સ્ટેશનમાં ગ્રીન હાઉસ, નેટહાઉસ, ઇમ્પ્લીમેન્ટ શેડ, ફોડર શેડ, ખેડૂતોની તાલીમ અને મ્યુઝીયમ જેવી સુવિધાઓ પણ આવરી લઈ કૃષિ વિકાસ અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવામાં અગત્યનો ભાગ ભજવશે.

સર્વે મહાનુભાવોની હાજરીમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનું ઐતિહાસિક મ્યુઝીયમ જેમાં આ.કૃ.યુ. હસ્તકના જુદા જુદા કેન્દ્રોથી ઐતિહાસિક ચીજ વસ્તુઓ, સાહિત્ય, શીલ્ડ, મેડલ્સ, વિવિધ મહાનુભાવોની ઐતિહાસિક મુલાકાતના ચિત્રો, વિશ્વવિદ્યાલયમાં વર્ષ વાર થયેલ પ્રસંગની તવારીખ મુજબ તથા અન્ય રસપ્રદ ચીજોના સંગ્રહ સાથે ગાંધીબાપુનો ચરખો જેવી ઐતિહાસિક બાબતોની માહિતી પેઢી દર પેઢી મળતી રહે તે આશયથી કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ મ્યુઝીયમ પણ લોક હિતાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

અમૃત મહોત્સવના સમાપન સમારોહમાં સૌ પ્રથમ પ્રાર્થના ગીત તથા યુનિવર્સિટીના ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આચાર્ય અને ડીનશ્રી ડૉ. વાય. એમ. શુક્લ સાહેબે સર્વે મહાનુભાવો તથા સર્વે હાજર રહેલ આમંત્રિત મહેમાનો, દેશ-વિદેશમાંથી ઓન લાઇન માધ્યમથી જોડાયેલ સર્વનું સ્વાગત કર્યું હતું. સર્વેનું સ્વાગત કરતા તેઓશ્રીએ સંસ્થાનો ઇતિહાસ, વિકાસગાથા વર્ણવતા સમગ્ર અમૃત મહોત્સવ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી.

સમારંભના પ્રમુખ સ્થાનેથી આ.કૃ.યુ. ના કુલપતિશ્રીએ સર્વેને આવકારી કોલેજના સુવર્ણ ઇતિહાસને ધ્યાને રાખી કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ દ્વારા નવી બાબતો અને નવી શિક્ષણનીતીના અમલવારી સાથે વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવાની નેમ સાથે આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શતાબ્દી વર્ષમાં પહોંચતા આગામી 25 વર્ષમાં અમુત જેવું કાર્ય કરવાનું છે. નવી પેઢીના વૈજ્ઞાનિક ટીમની આગવી વિશેષતાઓની વાત કરી હતી. આકૃત્યું હમેશા સહકારીતાના ભાવે કદમ મિલાવી રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર રહેલ છે અને રહેશે. એમ જણાવતા પાઠક સાહેબણે અભિવાદન કર્યું હતું.

સચિવશ્રી કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ ભારત સરકાર અને મહાનિર્દેશક ભારતીય કૃષિ અનુસંધાન પરીષદના વડા ડૉ. હિમાંશુ પાઠક સાહેબે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા તેના હસ્તકની ઐતિહાસિક કોલેજના આંગણે સરદાર પટેલ સાહેબની ભૂમિમાં આવ્યાની અદમ્ય આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પાઠક સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજે હું તીર્થ યાત્રા એ આવ્યાનું પુણ્ય મેળવી રહ્યો છું. આણંદમાં આવી હું ખુબજ આનંદિત છું જ્યાંથી દેશને શ્વેતકાંતિ નો લાભ મળ્યો છે એવી પુણ્ય ભૂમિમાં આવ્યાનો મને ગર્વ છે. તેઓશ્રીએ કુલપતિશ્રી, ડૉ. કથીરિયા સાહેબને અભિનંદન આપતા જણાવ્યું કે આપની દીર્ઘ દ્રષ્ટિથી આગામી વર્ષો માટેની તૈયારી તથા ભૂતકાળને સાચવી તેનું જતન કરવાની આગવી સુઝથી હું પ્રભાવિત થયો છું. તેઓશ્રીએ કહ્યું કે ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ હરહમેશ સાથે છે તેવી ખાતરી આપતા સહકારની ભાવના વ્યક્ત કરી હતી.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, ડૉ. ઝેડ. પી. પટેલે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનો ગર્વ અનુભવતા સંસ્થા સાથેના પોતાના અનુભવો જણાવ્યા. તેઓશ્રીએ કૃષિ સ્નાતકોની અને સંસ્થાની બાબતો વિશે જણાવ્યું કે દરેક વિદ્યાર્થી પોતાની માતૃ સંસ્થા માટે ગર્વ રાખી તેની શ્રેષ્ઠતા માટે કંઈ પણ કરવું જોઈએ.

કોલેજના સ્થાપના માટે સ્વ. શેઠ અમૃતલાલ હરગોવિંદદાસના સપનાને સાકાર થતું અને દેશના ખેડૂતો માટે રાષ્ટ્રના આર્થિક કરોદરજીવું બનવામાં પોતાનો ફાળો આપનાર કોલેજના વિકાસગાથા જોઈને, અનુભવીને દાનવીર શેઠના પૌત્ર અમિતભાઈ શેઠે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને નિયામકશ્રીએ કોલેજ દ્વારા નક્કી કરેલ ધ્યેયોને હાંસલ કરવામાં સફળ રહેલ છે અને દરેક ક્ષેત્રમાં આગવું પ્રદાન આપી રહેનાર સંસ્થાને તથા સર્વે અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે આભારની લાગણી સાથે જણાવ્યું કે ભૂતકાળને વાગોળી ભવિષ્યની આશા સાથે આત્મનિર્ભર ભારત બનાવવા દેશને સમર્પિત થઈ જવાની હાકલ કરી હતી.

આ અમૃત મહોત્સવના ઊજવણી વર્ષ દરમ્યાન થયેલ વિવિધ પ્રકાશનો, કાર્યક્રમોની ઝાંખી દર્શાવતા આયામને મહાનુભાવો દ્વારા ખુલ્લા-વિમોચન કરવામાં આવ્યા હતા. સંસ્થામાં પોતાના વિશિષ્ટ યોગદાન બદલ ભૂતપૂર્વ વિદ્યાશાખાધ્યક્ષશ્રીઓ તથા અન્ય વૈજ્ઞાનિકશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અમૃત મહોત્સવાના ઊજવણી સમાપન સમારોહમાં કેન્દ્રના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા રાજ્યના મંત્રીઓ અને સંતો દ્વારા શુભેચ્છા સંદેશો મોકલવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. રુચા દવે તથા પ્રા. નિખિલ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ કો-ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી, અમૃત મહોત્સવ ડૉ. ડી. બી. સીસોદીયા દ્વારા કરવામાં આવી હતી.





